

માર્ચ 2, 2018

## કેનેડિયન બ્લડ સર્વિસીસ (રક્ત સેવાઓ) બ્રામ્પટનમાં વિસ્તરણ કરે છે

### 90 નોકરીઓ ઉમેરીને, નવી અત્યાધુનિક ટેસ્ટિંગ લેબોરેટરી ખોલે છે

કેનેડિયન બ્લડ સર્વિસીસે શહેરના પૂર્વ છેડે સ્થિત પોતાના બ્રામ્પટન બ્લડ પ્રોડક્શન એન્ડ ડિસ્ટ્રિબ્યુશન સેન્ટરમાં નવી ટેસ્ટિંગ લેબોરેટરી ખોલી. 28,000 ચોરસ ફૂટમાં અત્યાધુનિક પ્રયોગશાળાનો ઉમેરો એક બાયોલોજિકલ મેન્યુફેક્ચરર તરીકે સંસ્થાની ઉત્પાદકતા સુધારે છે, અને સુરક્ષિત અને સલામત રક્ત તંત્ર માટે કાર્યક્ષમતા પરિપૂર્ણ કરે છે.

બ્રામ્પટન કમ્યુનિટી અને કેનેડિયન બ્લડ સર્વિસીસની કામગીરીઓના સંખ્યાબંધ પરિબલોમાં રોકાણ કરીને, આ સગવડ ઉત્પાદકતા વધારે છે, હોસ્પિટલોને અપાતી સેવાઓ સુધારે છે, સંચાલન ખર્ચો ઘટાડે છે અને તમામ કેનેડિયન નાગરિકો માટે સુધારેલું મૂલ્ય વિતરિત કરે છે. રોકાણ નવી બ્રામ્પટન ફેસિલિટીમાં પ્રાદેશિક ટેસ્ટિંગ કામગીરી પર ધ્યાન કેન્દ્રિત કરે છે અને ભવિષ્યમાં વિસ્તરણની છૂટ આપે છે.

કેનેડિયન બ્લડ સર્વિસીસે શુક્રવાર, માર્ચ 2 નાં રોજ નવી ટેસ્ટિંગ લેબોરેટરીની ભવ્ય શરૂઆત અને મીડિયા ટૂરનું આયોજન કર્યું છે.

કેનેડિયન બ્લડ સર્વિસીસ બ્રામ્પટનના વિકસતા આરોગ્ય અને જીવન વિજ્ઞાન ક્ષેત્રમાં મહત્વનું સ્થાન ધરાવે છે. આ ક્ષેત્ર શહેરના આર્થિક વિકાસ પ્રયત્નો માટે ધ્યાન આકર્ષતું કેન્દ્ર છે, જે વિકાસ અને રોકાણને ચલિત કરવામાં મદદરૂપ થવા સમર્પિત સંસાધનો અને સહાયતા પૂરી પાડશે. સીટી રોજગાર અને નવીન શોધ સરળ બનાવવા આરોગ્ય ક્ષેત્રના ધંધાઓ, સંભાળ પૂરી પાડનારાઓ અને જાહેર ક્ષેત્રની સંસ્થાઓ સાથે ભાગીદારીઓ કરવામાં સક્રિય ભૂમિકા ભજવી રહ્યું છે.

કંપની માટે મહત્વનો રોકાણ નિર્ણય શહેરની સમીપના ત્રણ મોટા હાઈવે — 401, 427 અને 407 — અને ટોરોન્ટો પીયર્સન ઈન્ટરનેશનલ એરપોર્ટ માટેનો હતો. રક્ત નમૂનાઓ ઝડપથી ટેસ્ટિંગ માટે બ્રામ્પટન મોકલી શકાય છે, જે સુરક્ષિત રક્ત ઉત્પાદોને ઝડપથી હોસ્પિટલો સુધી પહોંચાડવામાં મદદરૂપ થાય છે. નવી બ્રામ્પટન ટેસ્ટિંગ લેબોરેટરી બાયોમેડિકલ વેસ્ટ (જૈવિક-તબીબી કચરો) અને ડિકન્ટામિનેશન (વિશુદ્ધિકરણ) ઉપાડવા માટેના ખર્ચો ઘટાડે છે.

બ્રામ્પટન એક્સ્પાન્સન બ્રામ્પટન સમુદાયમાં નોંધપાત્ર રોકાણનું પ્રતિનિધિત્વ કરે છે, અને સમગ્ર પ્રાંતમાં સંજીવની ઉત્પાદો ખસેડવામાં સમુદાયોને મદદરૂપ થાય છે. એકંદરે, કેનેડિયન બ્લડ સર્વિસીસ પોતાની બ્રામ્પટન ફેસિલિટીમાં આશરે 400 લોકોને રોજગાર પૂરો પાડે છે. બ્રામ્પટનની ટેસ્ટિંગ લેબોરેટરી કેનેડાના પૂર્વીય અર્ધભાગ માટે ડોનર (દાતા) ટેસ્ટિંગ પ્રવૃત્તિઓ કરે છે, જે કેનેડાના દાતા પરીક્ષણના 60 ટકાનું પ્રતિનિધિત્વ કરે છે.

#### અવતરણો (ક્વોટ્સ):

“હું કેનેડિયન બ્લડ સર્વિસીસને તેઓના વિસ્તરણ બદલ અભિનંદન આપવા ઈચ્છું છું, અને આપણાં સમુદાયમાં તેઓના મહત્વના રોકાણ માટે તેઓનો આભાર માનું છું. રક્તદાન કરવાની વાત આવે ત્યારે હું જાણું છું કે બ્રામ્પટનના લોકો પગલું ભરવા હંમેશા તૈયાર અને રાજી હોય છે.”

મેયર લિન્ડા જેફ્રી (Linda Jeffrey)

“બ્રામ્પટનમાં કેનેડિયન બ્લડ સર્વિસીસનું વિસ્તરણ શહેર અને સંસ્થા માટે એક ચડિયાતા સમાચાર છે. તેઓને બ્રામ્પટનના મહાન સ્થળમાંથી, પરિવહન અને માળખાકીય સગવડોની પહોંચથી લાભ મળશે, અને બ્રામ્પટનને ઉચ્ચ-વિકાસ ક્ષેત્ર અને નવી ઉચ્ચ-કુશળતા ધરાવતી નોકરીઓમાંથી લાભ મળશે. કેનેડિયન બ્લડ સર્વિસીસને પોતાની ભવ્ય શરૂઆત બદલ અભિનંદન.”

સીટી કાઉન્સિલર જેફ બોવમેન (Jeff Bowman), ચેરમેન, ઈકોનોમિક ડેવલપમેન્ટ એન્ડ કલ્ચર (આર્થિક વિકાસ અને સંસ્કૃતિ)

“આપણાં શહેરમાં કેનેડિયન બ્લડ સર્વિસીસના વિસ્તરણથી અમે બહુ રોમાંચિત છીએ. આ અમારા માટે વ્યૂહાત્મક વિકાસ ક્ષેત્ર છે, અને આપણે સાથે મળીને વૃદ્ધિ પામીએ ત્યારે આરોગ્ય અને જીવન વિજ્ઞાન ક્ષેત્રમાં સુદૃઢ ભાગીદારીઓ તેમજ રોકાણ વિસ્તરણ જરૂરિયાતોને સહાયતા કરીને, અમે તેઓ અને અન્ય ધંધાઓ સાથે કામ કરવાની આશા રાખીએ છીએ.”

બોબ ડાર્લિંગ (Bob Darling), ડાયરેક્ટર, ઈકોનોમિક ડેવલપમેન્ટ એન્ડ કલ્ચર

-30-

બ્રામ્પટનમાં મોટા પાયે ફેરફારો થઈ રહ્યાં છે. આપણે વેધક ધ્યાન કેન્દ્રિત કરતા ભવિષ્ય માટે તૈયાર સંસ્થા છીએ. આપણે આપણાં સમુદાયની વૃદ્ધિ જાણીએ છીએ, જુવાની અને વિવિધતા આપણને અલગ અલગ કરે છે. આપણે કેનેડાના નવીન શોધ કરતા સુપર કોરિડોરના કેન્દ્રમાં સ્થિત, રોકાણ પ્રોત્સાહક અને આપણી વૈશ્વિક સફળતા વિકસાવનાર છીએ. આપણે કંપાયમાન શહેરી કેન્દ્રો વિકસાવીએ છીએ જે તક પ્રજ્વલિત કરે છે અને અહીં રહેતા અને કાર્યરત લોકોમાં ગૌરવ રેડીએ છીએ. આપણે બ્રામ્પટનને આગળ વધારી રહ્યાં છીએ જે તેને નવીનતમ, સર્વગ્રાહી અને જુરસામય શહેર બનાવે. અમને [Twitter](#) અને [Facebook](#) પર અનુસરો. [www.brampton.ca](http://www.brampton.ca) પર વધુ માહિતી જાણો.

**મીડિયા સંપર્ક (MEDIA CONTACT)**

બ્રાયન સ્ટિટલ (Brian Stittle)  
સીનિયર મીડિયા કોર્ડિનેટર (Sr. Media Coordinator)  
સીટી ઓફ બ્રામ્પટન (City of Brampton)  
905.874.2143 | [brian.stittle@brampton.ca](mailto:brian.stittle@brampton.ca)